


## નામાનાં મૂળતત્વો - ભાગ 1

**IMP** - અતિ ટુંક જવાબી પ્રશ્નો



ધોરણ 12 - કોમર્સ

12 કોમર્સ - Smart PDFs

માટે નીચેની લિંક પર ક્લિક કરો અથવા QR Code સ્કેન કરો

<https://bit.ly/4aZjuwy>



## Chapter 01 - ભાગીદારી : વિષય - પ્રવેશ

પુછાયેલ નથી

## Chapter 02 - ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો (નાણાકીય પત્રકો)

પુછાયેલ નથી

## Chapter 03 પાઘડીનું મૂલ્યાંકન

1) પાઘડી એટલે શું ? (March-2019, March-2022, July-2022)

❖ અપેક્ષિત નફા કરતાં વધુ નફો કમાવવાની ધંધાની પ્રતિષ્ઠાના મૂલ્યને પાઘડી કહે છે.

2) પાઘડી એ કેવા પ્રકારની મિલકત છે ? (March-2018)

❖ પાઘડી એ ધંધાની બજારમાં પ્રતિષ્ઠાનું મૂલ્ય દર્શાવતી અદૃશ્ય મિલકત છે.

3) પાઘડી પાકા સરવૈયામાં કયા મથાળા હેઠળ દર્શાવવામાં આવે છે ?

(August-2020, March-2024, July-2023)

❖ પાઘડી પાકા સરવૈયામાં મિલકત-લેણાં બાજુ બિનચાલુ મિલકતોના મથાળા હેઠળ દર્શાવવામાં આવે છે.

4) મૂડીકૃત નફો એટલે શું ? (July-2018, May-2021)

❖ મૂડીકૃત નફો એટલે અપેક્ષિત વળતરના દરના આધારે સરેરાશ નફાની મૂડીકૃત કિંમત

5) અધિક નફો એટલે શું ? (July-2019, March-2023)

❖ જ્યારે ધંધો અપેક્ષિત નફા કરતા વધુ નફો કમાતો હોય તો વધારાના નફાને અધિક નફો કહે છે.

6) અધિક નફાનું સૂત્ર જણાવો. (March-2020)

❖ અધિક નફો = સરેરાશ નફો - અપેક્ષિત નફો

7) મૂડીકૃત નફો મેળવવાનું સૂત્ર જણાવો. (June-2024)

❖ સરેરાશ નફો / અપેક્ષિત વળતરનો દર %

## Chapter 4 ભાગીદારીનું પુનર્ગઠન

1) ભાગીદારી પેઢીનું પુનર્ગઠન એટલે શું ? (March-2020, March-2022, Aug-2020, July-2023)

❖ ભાગીદારી પેઢીનું પુનર્ગઠન એટલે જુદાં-જુદાં કારણોસર ભાગીદારીમાં થતો ફેરફાર

2) ત્યાગનું પ્રમાણ એટલે શું ? (March-2018)

- ❖ જ્યારે ચાલુ ભાગીદારો વચ્ચે નફા-નુકસાનની ફાળવાણીના પ્રમાણમાં ફેરફાર થાય ત્યારે અમુક ભાગીદારોના નફાના પ્રમાણમાં ઘટાડો થાય છે. એટલે કે પહેલાં કરતાં નફામાં ઓછો ભાગ મળે છે. આવા ભાગીદારના નફાના પ્રમાણમાં જે ઘટાડો થાય છે તે પ્રમાણને 'ત્યાગનું પ્રમાણ' કહેવાય છે.

3) એકત્રિત નફાની વહેંચણી કઈ રીતે થાય ? (March-2019, July-2019)

- ❖ એકત્રિત નફાની વહેંચણી ચાલુ ભાગીદારો વચ્ચે નફા-નુકસાનના વહેંચણીનાં જૂનાં પ્રમાણમાં થાય છે.

નફા-નુકસાન ખાતે ઉ. ....

તે ભાગીદારોના મૂડી / ચાલુ ખાતે .....

4) પુનઃમૂલ્યાંકન ખાતાંને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે ?

(July-2018, July-2019, May-2021)

- ❖ પુનઃમૂલ્યાંકન ખાતાંને નફા-નુકસાન હવાલા ખાતાનાં નામથી ઓળખવામાં આવે છે.

5) પુનઃમૂલ્યાંકન વખતે મિલકતોની કિંમતમાં વધારો થાય ત્યારે કઈ આમનોંધ થાય ? (July-2022)

- ❖ જે-તે મિલકતો ખાતે ઉ. ....

તે પુનઃમૂલ્યાંકન ખાતે .....

6) પુનઃમૂલ્યાંકન ખાતું ક્યારે ઉધાર કરવામાં આવે છે ? (May-2021)

- ❖ મિલકતની કિંમતમાં ઘટાડો અને દેવાંની કિંમતમાં વધારો થાય ત્યારે પુનઃમૂલ્યાંકન ખાતું ઉધાર કરવામાં આવે છે.

7) પુનઃમૂલ્યાંકન ખાતાંનો નફો કે નુકસાન કયા ખાતે લઈ જવામાં આવે છે ? (March-2023)

- ❖ પુનઃમૂલ્યાંકન ખાતાંનો નફો કે નુકસાન ચાલુ ભાગીદારોના મૂડી/ચાલુ ખાતે નફા-નુકસાન વહેંચણીના જૂના પ્રમાણમાં લઈ જવામાં આવે છે.

8) ભાગીદારી પેઢીના એકત્રિત નફાની રકમની વહેંચણી અંગેની નમુનાની આમનોંધ લખો ? (March-2024)

- ❖ નફા-નુકસાન ખાતે ઉ. ....

તે ભાગીદારોના મૂડી | ચાલુખાતે .....

#### Chapter -05 ભાગીદારનો પ્રવેશ

1) ત્યાગનું પ્રમાણ એટલે શું ? તે કેવી રીતે શોધવામાં આવે છે ? (March-2018)

- ❖ નવા ભાગીદારને ભવિષ્યના નફામાં નક્કી કરેલ ભાગ મળે છે, જે જૂના (ચાલુ) ભાગીદારો તેમના નફામાંથી ભાગ કાઢીને નવા ભાગીદારને ભાગ આપે છે, તેને ત્યાગ કહેવાય.

જૂના ભાગીદારનો ત્યાગ = જૂનો ભાગ - નવો ભાગ

2) નવા ભાગીદારના પ્રવેશ વખતે મિલકતો અને દેવાનું પુનઃમૂલ્યાંકન શા માટે કરવામાં આવે છે ? (July-2018)

- ❖ નવા ભાગીદારને તેના પ્રવેશની તારીખ સુધીમાં મિલકતો અને દેવાંની કિંમતમાં થતા ફેરફારને પરિણામે થતો નફો કે નુકસાનમાં ભાગ મળે નહિ. તેથી નવા ભાગીદારના પ્રવેશ વખતે મિલકતો અને દેવાનું પુનઃમૂલ્યાંકન કરવામાં આવે છે.
- 3) પુનઃ મૂલ્યાંકન ખાતું કયારે ઉધાર અને કયારે જમા કરવામાં આવે છે ? (March-2019, May-2021)
  - ❖ જ્યારે મિલકતોની કિંમતમાં ઘટાડો થાય કે દેવાની કિંમતમાં વધારો થાય ત્યારે પુનઃમૂલ્યાંકન ખાતું ઉધાર કરવામાં આવે છે.
  - ❖ જ્યારે મિલકતોની કિંમતમાં વધારો થાય કે દેવાંની કિંમતમાં ઘટાડો થાય ત્યારે પુનઃમૂલ્યાંકન ખાતું જમા કરવામાં આવે છે.
- 4) પાઘડી અંગે હિસાબી ધોરણ 26 માં આપેલ જોગવાઈ જણાવો. (July-2019)
  - હિસાબી ધોરણ 26 પ્રમાણે પાઘડી પેટે કોઈ અવેજ ચૂકવવામાં આવે ત્યારે જ પાઘડી મિલકત તરીકે ચોપડે દર્શાવવી જોઈએ. આંતરિક રીતે સ્વમૂલ્યાંકન કરેલ પાઘડી ચોપડે દર્શાવવી જોઈએ નહીં.
- 5) નવા ભાગીદારને મળતા હક જણાવો. (March-2020)
  - નવા ભાગીદારને ભવિષ્યમાં પેઢીની મિલકતોમાં ભાગ મળે છે અને ભવિષ્યમાં નફામાંથી નક્કી કરેલ નફાનો ભાગ મળે છે.
- 6) નવા ભાગીદારને પેઢીમાં કેવી રીતે પ્રવેશ મળે છે ? (July-2023)
  - ભાગીદારી કરારમાં નવા ભાગીદારના પ્રવેશ અંગે જોગવાઈ હોય તો તેને અનુસરીને કે પેઢીના બધા જ ચાલુ ભાગીદારોના સર્વાનુમતથી નવા ભાગીદારને પ્રવેશ આપવામાં આવે છે.
- 7) નવા ભાગીદારને કયા હેતુસર પેઢીમાં દાખલ કરવામાં આવે છે ? (March-2023)
  - (1) પેઢીને વધુ મૂડીની જરૂરિયાત પૂરી કરવા
  - (2) વધુ કાર્યશક્તિની જરૂરિયાત સંતોષવા
  - (3) ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુના કારણે
  - (4) કુશળ કર્મચારીને પેઢીનો ભાગીદાર બનાવવા વગેરે હેતુથી નવા ભાગીદારને પેઢીમાં દાખલ કરવામાં આવે છે.

#### Chapter 06 - ભાગીદારની નિવૃત્તિ/મૃત્યુ

- 1) નિવૃત્તિ કે મૃત્યુ વખતે ભાગીદારને તેના ભાગની પાઘડી કોના દ્વારા આપવામાં આવે છે ? શા માટે ?  
(March-2018, 2024, May-2021, July-2022, June-2024)
  - ❖ નિવૃત્તિ કે મૃત્યુ વખતે ભાગીદારને તેના ભાગની પાઘડી બાકીનાં ચાલુ રહેતા ભાગીદારો આપે છે.
  - ❖ ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ વખતે તેના નફાનો ભાગ બાકીના ભાગીદારોને મળે છે, જેના વળતર રૂપે આપે છે.
- 2) ભાગીદારની નિવૃત્તિ વખતે પેઢીના ચોપડે દર્શાવેલ જૂની પાઘડીની હિસાબી અસર સમજાવો. (Aug-2020)

- ભાગીદારની નિવૃત્તિ વખતે પેઢીનાં ચોપડે દર્શાવેલ જૂની પાઘડી નિવૃત્તિ થતા ભાગીદાર સહિત બધા જ ભાગીદારો વચ્ચે નફા-નુકસાનના જૂના પ્રમાણમાં માંડી વાળવામાં આવશે.

બધા ભાગીદારોમાં મૂડી / ચાલુ ખાતે ઉ. ....

તે પાઘડી ખાતે .....

- નિવૃત્ત થતા ભાગીદારને ચૂકવવાની બાકી રકમ પર ભાગીદારી કરારમાં કોઈ ઉલ્લેખ ન હોય તો કેટલા ટકા વાર્ષિક વ્યાજ ચૂકવવાપાત્ર છે ? **(March-2022)**

- નિવૃત્ત થતા ભાગીદારને ચૂકવવાની બાકી રકમ પર ભાગીદારી કરારમાં કોઈ ઉલ્લેખ ન હોય તો વાર્ષિક 6 % વ્યાજ ચૂકવવાપાત્ર છે.

### Chapter 7 ભાગીદારી પેઢીનું વિસર્જન

- પેઢીના વિસર્જન સમયે વિસર્જન ખર્ચ કોણે ભોગવવાનો હોય છે ?

**(March-2018, March-2022, March-2024, May-2021)**

- પેઢીના વિસર્જન સમયે ભાગીદારી પેઢીનો વિસર્જન ખર્ચ સામાન્ય રીતે પેઢીએ ભોગવવાનો હોય છે.

- પેઢીના વિસર્જન સમયે અગાઉ માંડી વાળેલ ધાલખાધ પરત મળે, ત્યારે તેની નોંધ કયાં થાય છે. ?

**(March-2019)**

- પેઢીના વિસર્જન સમયે અગાઉ માંડી વાળેલ ધાલખાધ પરત મળે, તો તે માલ - મિલકત નિકાલ ખાતે જમા કરવામાં આવે છે.

- મરજિયાત વિસર્જન એટલે શું ? **(March-2020, March-2022, May-2021)**

- બધા ભાગીદારોની સર્વસંમતિથી ગમે તે સમયે પેઢીનું વિસર્જન થઈ શકે છે, તેને મરજિયાત વિસર્જન કહે છે.

- ભાગીદારી પેઢીના વિસર્જનની રીતો જણાવો. **(July-2018, July-2022, June-2024)**

- ભાગીદારી પેઢીનું વિસર્જન નીચેની બે રીતે કરવામાં આવે છે :

(1) સામાન્ય વિસર્જન (2) અદાલતના હુકમથી વિસર્જન

- ભાગીદારીના વિસર્જનનો અર્થ સમજાવો. **(March-2024, June-2024)**

- ભાગીદારી પેઢીમાં કોઈ ભાગીદારના પ્રવેશ, નિવૃત્તિ કે મૃત્યુને કારણે ભાગીદારીનું સ્વરૂપ બદલાય, ભાગીદારો બદલાય પરંતુ પેઢીનું વિસર્જન થતું ન હોય તેને ભાગીદારીનું વિસર્જન કહે છે.

- ભાગીદારી પેઢીનું વિસર્જન એટલે શું ? **(July-2022, July-2023, Aug-2020)**

- કાયદાકીય દૃષ્ટિએ પેઢીનું અસ્તિત્વ કાયમ માટે મટી જાય (જતુ રહે) ત્યારે ભાગીદારી પેઢીનું વિસર્જન થયું કહેવાય.

- પેઢીના વિસર્જન સમયે પાકા સરવૈયામાં દર્શાવેલ પ્રોવિડન્ટ ફંડની બાકીનો નિકાલ કેવી રીતે કરશો ? **(July-2019)**

ધોરણ 12 - કોમર્સ - નામાનાં મૂળતત્વો - અતિ ટૂંક જવાબી પ્રશ્નો = - by

- પ્રોવિડન્ટ ફંડ એ પેઢીનું દેવું હોવાથી, પ્રોવિડન્ટ ફંડ ખાતું બંધ કરીને માલ - મિલકત નિકાલ ખાતાની જમાબાજુએ લઈ જવાશે.

પ્રોવિડન્ટ ફંડ ખાતે ઉ. ....

તે માલ - મિલકત નિકાલ ખાતે .....

8) માલ-મિલકત નિકાલ ખાતાને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે ? (March-2023)

- સંપાદન ખાતું

Result 2024 - 25

# દિવ્ય ભાસ્કર

ફોકસ કોચિંગના સીએ ફાઉન્ડેશનના  
ટોપર વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા



સુરત: ફોકસ સીએ કોચિંગના વિદ્યાર્થીઓએ ફાઉન્ડેશનમાં  
ટોપ-10માં સ્થાન મેળવ્યું છે.



Kevin Thummar



Greny Gondaliya



Focus CA Coaching નાં રૅન્કર વિદ્યાર્થી મિત્ર ચલોડીયાનું  
માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા સન્માન 2021-22



Jiya Desai



Ravi Bhojani



Tarun Kalsariya

સુરત **TOP 10** રૅન્ક માં **Focus CA Coaching** નાં **3** વિદ્યાર્થી

Year 2023-24

All India રૅન્કમાં સ્થાન મેળવવા બદલ સન્માન



Akshit Anghan  
2019 - 20



Akash Lashkari



Gautam Sutariya  
2018 - 19



Naitik Vaghani



CA - Foundation Highest Passout in Surat 2018-19

સુરત ટોપ 5 માં Focus નાં 4 વિદ્યાર્થીના રૅન્ક



CA-CPT Highest Passout in Surat 2017-18



2014 Payal Daivada  
કલેક્ટર દ્વારા સન્માન



2013 Rajesh Nakrani  
મેયર દ્વારા સન્માન

Focus CA Bhavan, 8, Ramnagar Society, Hirabaug,  
Surat 395006 M. 90 99 399 299 / 97120 99299